

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૮/૦૨/૨૦૨૧ થી તા.૧૪/૦૨/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઈ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :

- (૧) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૮૦૦૬૨૧૦૧૦૬/૨૦૨૧ IPC ક. ૩૭૯, મુજબ રામાભાઈ રાજાભાઈ થાપલીયા ઉ.વ.૪૮ જાતે મેર ધંધો ડ્રાઇવીંગ રહે.બોખીરા તુંબડા હનુમાન મંદિર વાળી ગલી પોરબંદર મો.નં.૭૦૪૧૬ ૪૫૦૪૩ ફરીયાદીનો બ્લુ કલરનો OPPO કંપનીનો A11K મોડલનો ચાલુ હાલતનો મોબાઇલ ફોન જેના IMEI નં.૮૬૬૩૨૪૦૪૯૫૦૧૭૭૫ નો કિ.રૂ.૭૦૦૦/- નો ફરીયાદીના શર્ટના ખીસ્સામાં રાખેલ જે મોબાઇલ ફોન ફરીયાદીની નજર ચુકવી કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય. કીર્તિમંદિર પો.સ્ટેના PI એચ.એલ.આહીર તથા PSI આર.એલ.મકવાણા, UHC એમ.કે.માવદીયા, UHC બી.પી.કારેણા, LR ભીમા દેવાભાઈ ઓડેદરા, LR ભરત નાથાભાઈ શીંગરખીયા LR અરવીંદ કાનાભાઈ શામળા વીગેરે પો.સ્ટાફએ પોકેટકોપ/ઈ-ગુજકોપ મુજબ આરોપીનો પૂર્વ ઇતિહાસ જાણી અને કામગીરી કરેલ જેમાં કીર્તિમંદિર પો.સ્ટેના ગુ.ર.ન ૧૧૨૧૮૦૦૬૨૧૦૧૦૬/૨૦૨૧ IPC કલમ ૩૭૯ મુજબ ના કામના આરોપી અશગર ઉર્ફે કાલો ઉમરભાઈ સેતા જાતે-સિંધી ઉ.વ.૩૨ ધધો-મજુરી રહે. ઠક્કરપ્લોટ શાહ મુરાદશાહના પીરનો તાકીયામાં પોરબંદર મુજબના આરોપીને મોબાઇલ સાથે શોધી કાઢેલ છે
- (૨) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન સી.આર.પી.સી.ક.૮૨ મુજબ મે.ચીફ.જ્યુડી.મેજી સાહેબની કોર્ટમાં છેલ્લા ૨૦ વર્ષથી મુદતમાં હાજર નહિ રહેનાર અને પોતાની પકડથી બચવા નાસતા ફરતા અને પોતાના અલગ અલગ જગ્યાએ રહેણાંક બદલતો આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. ક.૮૨ મુજબનુ જાહેરનામુ પ્રસિધ્ધ કરતા કીર્તિમંદિર પો.સ્ટેના PI એચ.એલ.આહીર તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા રાજકોટ ખાતે શોધ ખોળ માટે મોકલતા તપાસ દરમ્યાન નાસતો ફરતો આરોપી રાજપુરી કૈલાસપૂરી ગોસાઈ ઉ.વ.૪૮ રહે.”માં” જ્યોતીનગર બંધ શેરી કિસ્ટલ મોલ પાછળ રાજકોટ ખાતેથી મળી આવતા આરોપીને પકડી નામદાર ચીફ જ્યુડી.મેજી.સાની કોર્ટ રજુ કરેલ છે
- (૩) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ડો.પો.અ.નં ૫૯૦/૨૦૧૯ મુજબ જુનાગઢ ફેમિલી કોર્ટના મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા ભરણ પોષણની રકમ રૂ.૫૦૫૦૦/- સમયસર જમા નહીં કરાવનાર આરોપી ઓસમાન આમદભાઈ ઉઠાર રહે. ઠક્કર પ્લોટ, પોરબંદર વાળાને નવ માસની સજાનું વોરન્ટ ઇસ્યુ કરેલ હોય, જેથી કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એચ.એલ.આહીર સાહેબના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના પો.સબ.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મજીઠીયા તથા ચન્દ્રજિતસિંહ અરશીભાઈ જાદવ દ્વારા જરૂરી વોચ ગોઠવી આજદિન સુધી સજાથી બચવા નાસતો ફરતો આરોપી ઓસમાન આમદભાઈ ઉઠાર રહે. ઠક્કર પ્લોટ, પોરબંદર વાળાને શોધી કાઢી પોરબંદર જિલ્લા જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરી એક નિર્બળ અબળાને ન્યાય અપાવવા પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા પગલાં લેવામાં આવેલ છે.
- (૪) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન અમરેલી સીટી પો.સ્ટે ગ.ર.ન. ૧૧૧૯૩૦૦૩૨૧૦૧૫૭/૨૦૨૧ IPC ક. ૪૦૬,૪૨૦ મુજબ અમરેલીના નોકરીયાત ધર્મેન્દ્રભાઈ સિદ્ધપુરા રહે. અમરેલી આ કામના આરોપીએ ફરીયાદીના નામે લોન લઈ કાર નં.GJ 18 BJ 7777ની ખરીદી લોનના હપ્તા નહીં ભરી ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી એચ.એલ.આહીર સાહેબના માર્ગદર્શન હેઠળ હનુમાનગુફા પોલીસ ચોકીના પો.સબ.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ

જયેશભાઈ મજીઠીયા તથા ચન્દ્રજિતસિંહ અરશીભાઈ જાદવ તથા મયુરભાઈ આગઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પો.સબ.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલાને હકીકત મળેલ કે અમરેલી વૃંદાવન પાર્કમાં રહેતા ધર્મેન્દ્રભાઈ સિદ્ધપુરા નામના નોકરીયાતને છેતરી તેમના નામે લોન લઈ આરોપી મહેશભાઈ ઉર્ફે ભાણકુભાઈ ભુપતભાઈ બસીયા રહે. અમરેલી વાળાએ કાર નં. GJ 18 BJ 7777ની ખરીદી લોનના હપ્તા નહીં ભરી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હે નોંધાયેલ હોય જે ગુન્હામાં સંડોવાયેલ કાર પોરબંદર જિલ્લામાં હોવા અંગે માહિતી મળતા પોરબંદર જિલ્લા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગના પો.સબ ઈન્સ. પ્રતિક પટેલ તથા તેમની ટીમની મદદ મેળવી પો.સબ.ઇન્સ.શ્રી બી.એસ.ઝાલા તથા હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ મજીઠીયા તથા ચન્દ્રજિતસિંહ અરશીભાઈ જાદવ તથા મયુરભાઈ આગઠ દ્વારા જરૂરી વોચ ગોઠવી સદર કારને શોધી કાઢી અમરેલી સીટી પોલીસને સોંપી આપેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર